

VacSwim હોલિડે સ્વિમિંગ પ્રોગ્રામ

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

આમાં કોણ નોંધણી કરાવી શકે છે?

5 થી 17 વર્ષના બાળકો

હું મારા બાળકની નોંધણી કેવી રીતે કરાવી શકું છું?

નોંધણી કરાવવાનો સૌથી સરળ રસ્તો education.wa.edu.au/vacswim પર ઓનલાઇન નોંધણી કરવાનો છે. તમે અમારી વેબસાઇટ પરથી નોંધણી ફોર્મ ડાઉનલોડ કરીને અને ભરીને તેને અમારા નીચેના સરનામે નોંધણીની છેલ્લી તારીખ સુધી તે પહોંચે તે રીતે ટપાલ દ્વારા મોકલી આપી શકો છો.

VacSwim
Department of Education
Statewide Services Centre
33 Giles Avenue
Padbury WA 6025

(વેબસાઇટ પર) નીચેની ભાષાઓમાં અનુવાદિત કરેલ નોંધણી ફોર્મ ઉપલબ્ધ છે: અરેબિક, ગુજરાતી, હિંદી, ઇન્ડોનેશિયન, જાપાની, મલયાલમ, પર્શિયન, પંજાબી, સરળ ચીની, સ્પેનિશ, ટાગાલોગ, તામિલ, થાઈ, પારંપારિક ચીની, ઉર્દૂ અને વિયેતનામીસ.

તેનો ખર્ચ કેટલો છે?

પ્રોગ્રામ	સિંગલ	સિંગલ કન્સેશન	ફમિલી*	ફમિલી* કન્સેશન
જાન્યુઆરી પ્રોગ્રામ 1	\$31	\$20	\$83	\$55
જાન્યુઆરી પ્રોગ્રામ 2	\$31	\$20	\$83	\$55
જાન્યુઆરી 5 દિવસ	\$16	\$11	\$42	\$28
દેશ વહેલો પ્રારંભ	\$31	\$20	\$83	\$55

*ફમિલી નોંધણીમાં એક જ સરનામે રહેતા ત્રણ કે તેથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

કિંમતોમાં પૂલ એન્ટ્રીનો સમાવેશ નથી.

કન્સેશન મેળવવા માટે કોણ પાત્ર હશે?

નીચે માંથી કોઈ પણ એક કન્સેશન કાર્ડ ધરાવતી કોઈ પણ વ્યક્તિ:

- કંપેનિયન કાર્ડ
- કોમનવેલ્થ સિનિયર્સ હેલ્થ કાર્ડ
- ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેયર્સ (ગોલ્ડ, વ્હાઇટ, ઓરેંજ)
- હેલ્થ કેર કાર્ડ
- આઉટ ઓફ સ્ટેટ સિનિયર્સ કાર્ડ
- પેન્શનર કન્સેશન કાર્ડ
- સ્ટેટ કન્સેશન કાર્ડ
- WA સિનિયર્સ કાર્ડ

COVID-19 માટે કયા પગલાં લેવામાં આવ્યા છે?

VacSwim લેશન [WA ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ](#) દ્વારા હાલમાં આપવામાં આવેલ સૂચન મુજબ આયોજિત કરવામાં આવશે.

VacSwim વિશે વધુ માહિતી હું કેવી રીતે મેળવી શકું છું?

W: education.wa.edu.au/swimming
T: 9402 6412
E: vacswim@education.wa.edu.au

જાન્યુઆરી પ્રોગ્રામ

શું હું હમણાં મારા બાળકનું નામ જાન્યુઆરી પ્રોગ્રામમાં નોંધાવી શકું છું?

હા, જાન્યુઆરી પ્રોગ્રામ માટેની નોંધણી હવે શરૂ થઈ ગઈ છે.

જાન્યુઆરીના લેસન્સ ક્યારે છે?

જાન્યુઆરી પ્રોગ્રામ 1: મંગળવાર, 3 જાન્યુઆરી થી શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 સુધી.
જાન્યુઆરી 5 દિવસીય પ્રોગ્રામ: સોમવાર, 9 જાન્યુઆરીથી શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 સુધી.
જાન્યુઆરી પ્રોગ્રામ 2: સોમવાર, 16 જાન્યુઆરીથી બુધવાર, 25 જાન્યુઆરી 2023 સુધી.

આ લેસન્સ કેટલા સમય સુધી ચાલે છે?

જાન્યુઆરી પ્રોગ્રામ 1: 9 દિવસીય પ્રોગ્રામ માટે 40 મિનિટના લેસન. જાન્યુઆરી 5 દિવસીય પ્રોગ્રામ: 5 દિવસીય પ્રોગ્રામ માટે 35 મિનિટના લેસન. જાન્યુઆરી પ્રોગ્રામ 2: 8 દિવસીય પ્રોગ્રામ માટે 45 મિનિટના લેસન્સ.

જાન્યુઆરી લેસન્સ માટેની નોંધણી ક્યારે પૂરી થાય છે?

જાન્યુઆરી પ્રોગ્રામ 1: રવિવાર, 6 નવેમ્બર 2022
જાન્યુઆરી 5 દિવસીય પ્રોગ્રામ: રવિવાર, 6 નવેમ્બર 2022
જાન્યુઆરી પ્રોગ્રામ 2: રવિવાર, 13 નવેમ્બર 2022.

દેશ વહેલો પ્રારંભ

લેસન્સ ક્યારે છે?

શુક્રવાર, 16 ડિસેમ્બરથી શુક્રવાર, 23 ડિસેમ્બર 2022* સુધી
*આમાં શનિવારે અને રવિવારે પણ લેસન્સ રહેશે.

આ લેસન્સ કેટલા સમય સુધી ચાલે છે?

8 દિવસીય પ્રોગ્રામ માટે 45 મિનિટના લેસન્સ.

નોંધણી ક્યારે સમાપ્ત થાય છે?

રવિવાર, 30 ઓક્ટોબર 2022.